

14th November, 2024

To,
National Stock Exchange of India Limited,
Exchange Plaza,
Plot No. C/1, G Block,
Bandra - Kurla Complex, Bandra (E),
Mumbai – 400051.
NSE Symbol: JINDWORLD

To,
BSE Limited,
Listing Department,
Phiroz Jeejeebhoy Tower,
25th Floor, Dalal Street,
Mumbai – 400001.
Security Code: 531543

Subject: Submission of Newspaper Publications

Dear Sir / Madam,

Please find attached herewith the cutting of newspaper publications published on 14th November, 2024 in the following newspapers for “Un-audited Standalone and Consolidated Financial Results” for the quarter and half year ended on 30th September, 2024:

1. Indian Express - English Edition;
2. Financial Express - Gujarati Edition.

You are requested to take note of the above.

Thanking you,

Yours faithfully,
For **Jindal Worldwide Limited**

Durgesh D. Soni
Company Secretary & Compliance Officer
ICSI Membership No.: A38670

Encl.: As above

indianexpress.com



I arrive at a conclusion not an assumption.
Inform your opinion with detailed analysis.

The Indian EXPRESS
JOURNALISM OF COURAGE

Dakshin Gujarat Vij Company Limited
CIN U40102GJ2003GG042909
Bardoli Division
66 KV SS Compound, Surat-Bardoli Road, Bardoli 394 601
DGVCL Toll Free No. 19123 (or 1800 233 3003)

Tender Notice
Tenders (nos. 69 to 78) are invited from registered firms/parties for supply of various types material for TRU, LV brass & bushing, aluminum wire and work including laying, testing & commissioning of 11/22 KV underground XLPE cable (185 sq. mm. XLPE to be supplied by DGVCL) with cable end termination & straight through jointing kit (to be supplied by contractor) and fault finding, FRP fencing, transformer maintenance, hiring of crane and tower ladder vehicle, supply & installation of hardware of computer & printer's at various sub-divisions under Bardoli Division jurisdiction. For further details, please visit www.nprocure.com.
EE (O&M), Bardoli Division, DGVCL.
Install MCB/ELCB/RCCB & Prevent Electric Shocks/Electrical Accidents

PUBLIC NOTICE Company's Name : Hindustan Unilever Ltd.
Regd. office of the Company : Unilever House, 5D Savant Marg, Chakola, Andheri East, Mumbai 400099. Notice is hereby given that the certificate(s) for the mentioned securities of the company has been lost / misplaced and the holder(s) of the said securities have applied to the Company. Any person who has claim in respect of the said securities should lodge such claim with the company at its registered office within 15 days from this date else the company will proceed to issue Duplicate Share Certificate(s) without further intimation.

Name of the Holder	Folio No.	Kind of securities & face value	No. of Securities	Distinctive Nos.	Certificate No.
Hashumtiben Mahendrabhai Shah Snehal Mahendrabhai Shah Sujata Snehal Shah	HLL 272 9621	Equity Rs.1/-	450	876064381 to 876064830	5149209
			450		

Place : Ahmedabad, Date : 13-11-2024

GNFC Announces Rs. 102 crores Profit After Tax for the Second Quarter, & Rs. 217 crores for Half Year ended on 30.09.2024

Gandhinagar, 13th November, 2024, a meeting of the Board of Directors was held today to consider and approve the Unaudited Financial Results for Q-2 / H-1 FY 2024-25.

Shri Pankaj Joshi, IAS, Managing Director, GNFC, mentioned that there has been mixed sales pattern i.e. fertilizer sales improved whereas chemicals sales was to be held back mainly due to annual turn around at TDI Dahej plant.

Chemicals in general has been facing realisation pressure impacting both the revenue as well as operating profit. Due to a good combination of products, the company has remained resilient to such external market conditions which should, going forward, improve the overall results by increase in volume as well as better realisations.

On a YTD basis, fertilizer segment results improved due to higher volume in Neem Urea, reduced input cost in complex fertilizer and Lower fixed costs in both the fertilizers.

Chemicals segment witnessed the impact due to longer annual turn around of TDI Dahej complex which had its ripple impact on upstream production like CNA. Cumulatively, thus, operating profit remained lower to that extent.

With Dahej Complex now producing at full capacity coupled with stable Bharuch operations, the company expects to have better performance over next few quarters of FY 24-25.

PROCLAMATION REQUIRING THE APPEARANCE OF ACCUSED PERSON
(SEE SECTION 82 Cr.P.C.)

Whereas complaint has been made before me that accused person(s) Kiran Kumar Jethabhai Chaudhary, Prop. of M/s Hanuman Agro Centre, Shop No. 41, Property No. 28, 128 Railway Stop Road, Vill. & Teh. Dopdar, Distt. Banaskantha, Gujarat-385330 has committed (or is suspected to have committed) the offence in Case Reg. No. 2816/2020 U/s 138 NI Act, PS Model Town, Delhi and it has been returned to a Warrant of arrest thereupon issued that the said accused person(s) Kiran Kumar Jethabhai Chaudhary can not be found and whereas it has been shown to my satisfaction that the said accused person(s) Kiran Kumar Jethabhai Chaudhary has absconded (or is concealing himself to avoid the service of the said warrant). Proclamation is hereby made that the said accused person(s) Kiran Kumar Jethabhai Chaudhary of Case Reg. No. 2816/2020 U/s 138 NI Act, PS Model Town, Delhi is required to appear before this court to answer the said complaint on or before dated 24.01.2025

By Order
Himanshu Sehloth
Ld., JMFC-03,
Court No. 213 (North)
Rohini Courts, Delhi

DP/14928/NW/2024
(Court Matter)

CHARTERED LOGISTICS LIMITED
CIN: L74140GJ1995PLC026351
REGD.OFF: B-501, Stellar, Opp. Arista, Sindhu Bhawan Road, Thaltej, Ahmedabad, Gujarat-380059.
Tel.: 079-26891752; E-mail: cs@chartered.co.in Website: www.chartered.co.in

EXTRACTS OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024 (₹ In Lakhs)

Sr. No.	Particulars	Quarter ended		Half Year ended		Year Ended
		30/09/2024	30/09/2023	30/09/2024	31/03/2024	31/03/2024
1	Total income from operations (net)/Revenue	1663.55	1724.65	3914.29	7364.75	
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	36.92	-8.20	188.80	18.98	
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	36.92	-8.20	188.80	18.98	
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	30.92	-8.20	160.80	66.73	
5	Total Comprehensive Income (Comprising profit/ (loss) after tax and Other Comprehensive Income after tax)	30.92	-8.20	160.80	67.70	
6	Equity Share Capital	993.40	993.40	993.40	993.40	
7	Reserve (excluding revaluation Reserve) as shown in the Audited balance sheet of the previous year	-	-	-	-	
8	Earnings Per Share (of Re. 1/-each) (not annualised)					
a.	Basic:	0.03	-0.01	0.16	0.07	
b.	Diluted:	0.03	-0.01	0.16	0.07	

Note : 1. The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and half year ended September 30, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the BSE Ltd website (www.bseindia.com) and Company's website (www.chartered.co.in). 2. The above standalone unaudited financial results of the Company for the quarter and half year ended September 30, 2024 have been reviewed by an Audit Committee at its meeting held on November 13, 2024 and approved by the Board of Directors at their Meeting held on the same day. 3. This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable. 4. Figures have been regrouped wherever necessary. 5. The Company is operating in single segment, so above results are for single segment only.

For and on behalf of the Board of Directors,
For Chartered Logistics Limited,
Lalit Kumar Sandhi
Managing Director
DIN : 00618427

Place : Ahmedabad
Date : November 13, 2024

No. Q-15014/01/2023-CPA
Government of India
Ministry of Environment, Forest & Climate Change
2nd floor, Jal Wing, Indira Paryavaran Bhawan, Jor Bagh Road, New Delhi

Subject: Appointment of one (1) Full-time Member (Technical) in the Commission for Air Quality Management in NCR and Adjoining Areas -reg.

Applications are invited from eligible candidates for selection and appointment of one (1) Full-time Member (Technical) to the Commission for Air Quality Management in NCR and Adjoining Areas, Delhi.

2. The Commission for Air Quality Management in NCR and Adjoining Areas (CAQM) is a Statutory Body established under the Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Act, 2021 (29 of 2021). The Member shall be a full-time incumbent.

The detailed advertisement is available on the website of the Ministry at <https://moef.gov.in> and website of the CAQM at <https://caqm.nic.in>

Sd/-
(Ved Prakash Mishra)
Joint Secretary to the Government of India

CBC 13101/11/0008/2425

JINDAL JINDAL WORLDWIDE LIMITED
CIN : L17110GJ1986PLC008942
Regd.& Corp. Office : "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad -380015
Phone: 079-71001500 • Email Id: csjindal@jindaltextiles.com • Website : www.jindaltextiles.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter & Half Year Ended 30th September, 2024 {Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015} (₹. In Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended			Half Year Ended			Year Ended
		3 months ended of C.Y.	Preceding 3 months ended of C.Y.	Corr. 3 months ended in P.Y.	6 months ended of C.Y.	6 months ended of P.Y.	Previous Financial Year ended	
		30 th Sept, 2024 (Un-Audited)	30 th Sept, 2023 (Un-Audited)	30 th Sept, 2023 (Un-Audited)	30 th Sept, 2024 (Un-Audited)	30 th Sept, 2023 (Un-Audited)	31 st March, 2024 (Audited)	
STANDALONE								
1.	Total income from operations (net)	56758.92	51536.56	40019.89	108295.48	81856.19	185935.50	
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	2343.22	2327.22	1525.75	4670.44	3436.21	9,528.99	
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	2343.22	2327.22	1525.75	4670.44	3436.21	9,528.99	
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items)	1746.65	1742.65	1217.90	3489.30	2571.30	7,002.94	
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1746.65	1742.65	1217.90	3489.30	2571.30	6,748.61	
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31 st March 2024						69042.96	
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.87	0.87	0.61	1.74	1.28	3.49	
	2. Diluted :	0.87	0.87	0.61	1.74	1.28	3.49	
CONSOLIDATED								
1.	Total income from operations (net)	57080.62	48743.07	39182.52	105823.69	80252.95	1,81,408.90	
2.	Net Profit / (Loss) for the period (before Tax Exceptional and / or Extraordinary items)	2359.31	2445.91	1626.24	4805.22	3556.80	10249.58	
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	2359.31	2445.91	1626.24	4805.22	3556.80	10249.58	
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items)	1733.56	1806.30	1275.51	3539.86	2644.80	7564.78	
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1733.56	1806.30	1275.51	3539.86	2644.80	7310.45	
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31 st March 2024						69902.05	
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.86	0.90	0.64	1.77	1.32	3.77	
	2. Diluted :	0.86	0.90	0.64	1.77	1.32	3.77	

Notes :
1. The above Un-Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter and half year ended on 30th September, 2024 have been reviewed & recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on Wednesday, 13th November, 2024.
2. The Statutory Auditors of the Company have carried out Limited Review of the above Standalone & Consolidated Un-Audited Financial Results of the Company for the quarter and half year ended on 30th September, 2024 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued a Limited Review Report thereon.
3. The above financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices & policies to the extent applicable and disclose the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).
4. At standalone level, the Company is engaged in business of "Textile" and has only one reportable segment in accordance with Ind AS 108 'Operating Segments' therefore segment reporting as defined in Ind AS 108 is not applicable for the Standalone Financial Results for the Company. For Consolidated Financial Results, refer the Statement of Consolidated Segment Revenue, Results, Segment Assets and Liabilities.
5. The figures for the corresponding previous periods have been restated/regrouped wherever necessary, to make them comparable.
6. The figures for quarter ended on 30th September, 2024 forming part of the statement of Un-Audited Standalone & Consolidated Financial Statements are the balancing figure between the un-audited figures in respect of the half year ended on 30th September, 2024 and the published figures upto the first quarter of the financial year (FY 2024-2025) i.e. 30th June, 2024, which were subject to limited review by the Statutory Auditors.
7. Pursuant to compliance of SEBI notification No. SEBI/LAD-NRO/GN/2018/1 dated 9th May, 2018, Statements of Cash Flows (both Standalone & Consolidated) for the half year ended 30th September, 2024 have also been submitted by way of notes as enclosed herewith as Annexure-A to the said notes to Un-Audited Standalone And Consolidated Financial Results & Statement of Assets & Liabilities.
8. Statement of Un-audited Standalone & Consolidated Financial Results are also available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and on the website of the Company (www.jindaltextiles.com).

For and On Behalf of the Board
JINDAL WORLDWIDE LIMITED
Sd/-
AMIT AGRAWAL
Vice Chairman & Managing Director
DIN : 00169061

Date : 13th November, 2024
Place : Ahmedabad

SURAT TRADE AND MERCANTILE LIMITED
(Formerly known as Surat Textile Mills Limited)

Regd. Office: Tulsi Krupa Arcade, 6th Floor, Near Aai Mata Chowk, Puna-Kumbharia Road, Dumbhal, Surat 395010
CIN: L17119GJ1945PLC000214; Website: www.stml.in, e-mail: sharedept@stml.in Tel.No.(0261) 2311198

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED 30TH SEPTEMBER, 2024 (₹. In Lakh except per share data)

Sr. No.	Particulars	Quarter ended	Six Months ended	Corresponding
		30.09.2024 (Unaudited)	30.09.2024 (Unaudited)	Quarter ended 30.09.2023 (Unaudited)
1	Total income from Operations	2993.70	5983.84	2116.03
2	Net Profit for the period (before tax and exceptional items)	424.07	1028.79	269.29
3	Net Profit for the period before tax (after exceptional items)	424.07	1028.79	269.29
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional items)	404.74	965.01	183.88
5	Total Comprehensive Income for the period (after tax) [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	404.74	965.01	183.88
6	Paid-up Equity Share Capital (Face Value of Rs 1/- each)	2220.64	2220.64	2220.64
7	Reserve excluding Revaluation Reserves as at Balance Sheet date	-	-	-
8	Earnings Per equity share (Not Annualised)			
	Basic (in Rs.)	0.18	0.43	0.08
	Diluted (in Rs.)	0.18	0.43	0.08

Notes:
1. The above is an extract of the detailed format of Statement of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed financial results and this extract were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 13th November, 2024. The full format of the Statement of Financial Results are available on the Company's website (www.stml.in) and on the website of BSE Limited (www.bseindia.com).
2. Previous period's figures have been regrouped / reclassified wherever necessary, to conform to current period's classification.

For and on behalf of the Board of Directors
For Surat Trade and Mercantile Limited
Alok P. Shah
Managing Director
DIN: 00218180

Date : 13/11/2024
Place : Surat

MAHALAXMI RUBTECH LIMITED
CIN NO.: L25190GJ1991PLC016327
Regd. Office: 'Mahalaxmi House', YSL Avenue, Opp. Katav Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad - 380 015, Gujarat.
Ph. No.: 079 - 4000 8000, E-mail: cs@mahalaxmirubtech.com, Website: www.mrtglobal.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024 (₹ In Lacs, Except EPS)

Sr. No.	Particulars	Quarter Ended	Half Year Ended	Quarter Ended
		30.09.2024 (Unaudited)	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)
1	Total income from operations (Net)	2414.58	4516.04	1962.97
2	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and / or Extraordinary Item #)	480.94	874.28	256.52
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional and / or Extraordinary Item #)	480.94	874.28	256.52
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional and / or Extraordinary Item #)	349.07	674.96	183.84
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax)]	351.94	680.70	184.17
6	Equity Share Capital (Face Value of ₹ 10/- each)	1062.03	1062.03	1062.03
7	Earnings Per Share			
	Basic:	3.29	6.36	1.73
	Diluted:	3.29	6.36	1.73

There was no Exceptional and / or Extraordinary Item during the Second Quarter and Half Year ended on September 30, 2024.

Notes:-
1. The above is an extract of the detailed Unaudited Financial Results for the Second Quarter and Half Year ended on September 30, 2024, under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the Second Quarter and Half Year ended on September 30, 2024, are available on the Stock Exchanges' website i.e. www.bseindia.com & www.nseindia.com and on the Company's website i.e. www.mrtglobal.com.
2. The Unaudited Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective Meetings held on November 13, 2024.
3. The Hon'ble National Company Law Tribunal, Ahmedabad, Special Bench, Court-1, vide Order dated 04th March, 2024, sanctioned the Scheme of Arrangements involving Demerger between Mahalaxmi Rubtech Limited (MRT) (CIN: L25190GJ1991PLC016327) ("Demerged Company"); Mahalaxmi Fabric Mills Limited (MFML) (CIN: L17100GJ1991PLC015345) ("First Resulting Company"); and Globale Tessile Limited (GTL) (CIN: L17299GJ2017PLC098506) ("Second Resulting Company") and their respective Shareholders and Creditors ("Scheme"). The Scheme became effective on April 01, 2024, upon filing of the Certified Copy of the NCLT Order sanctioning the Scheme, by all the Companies, with the Registrar of Companies, Ahmedabad. These Financial Results have been prepared after giving effect of the Scheme w.e.f. April 01, 2024 i.e. Appointed Date. Accordingly, this Financial Results comprise of Financial Information for the Residual Undertakings of the Demerged Company.
4. Pursuant to the Scheme, Mahalaxmi Exports Private Limited has become the Subsidiary Company of MFML; and also Globale Tessile Private Limited has ceased to be the Subsidiary Company of MRT; and that MRT does not have any Subsidiary Company. Accordingly, MRT is required to submit only the Standalone Financial Results and the Consolidated Financial Results are not required to be prepared by the Company.
5. Financial Information for Quarter ended 30/09/2023 and Half Year ended 30/09/2023 have been restated, pursuant to the Scheme as mentioned in Note No. 3.
6. To facilitate comparison, figures of Residual Undertaking of the Demerged Company of previous periods have been regrouped, restated and rearranged, wherever necessary.
7. These Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards (IND AS) as specified in the Companies (Indian Accounting Standards) Rules, 2015 (As amended from time to time), Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (As amended from time to time), Circulars and Notifications issued thereunder.

By Order of the Board
For, Mahalaxmi Rubtech Limited
Sd/-
Rahul Jeetmal Parekh
Managing Director (DIN:- 00500328)

Place: Ahmedabad
Date: November 13, 2024

Ahmedabad

EXPRESS
Careers

RAILTEL CORPORATION OF INDIA LIMITED
(A Navratna CPSE under Ministry of Railways)
Registered & Corporate Office: Plate-A, 6th Floor, Office Block-II, East Kidwai Nagar, New Delhi-110023, website: www.railtel.in, CIN: L64202DL2000GOI107905

Indicative Notice for Direct Recruitment in RailTel Corporation- Vacancy Notice No. RCIL/2024/P&A/44/63

RailTel Corporation of India Limited, a Navratna Public Sector Undertaking under Government of India, invites applications from Indian Citizens for the following three no. of vacancies in General Administration (CS and Legal) Department:

- Assistant Manager/Legal (E-0 Level) (2 vacancies) : CTC (approx.) - Rs. 9 Lakh + PRP
- Assistant Company Secretary (E-1 Level) (1 vacancy): CTC (approx.) - Rs.12 Lakh + PRP

The applications in prescribed proforma should reach this office by post latest by 06.12.2024. The detailed notice and application form for the above vacancy notice may be accessed on RailTel's website <https://www.railtel.in/careers.html> under 'current job openings' section.

Sr. Deputy General Manager/HR

PUBLIC NOTICE
(Under Section 102 of the Insolvency and Bankruptcy Code, 2016)
FOR THE ATTENTION OF THE CREDITORS OF
UTKARSH MALVIK HATHI (Personal Guarantor/ Debtor)
RELEVANT PARTICULARS

1. Name of the Personal Guarantor (PG)	Utkarsh Malvik Hathi [PAN Number : AAXPH9535L]
2. Address of registered office / Principal Office / Residence of the Personal Guarantor (PG)	D-1, Janta Nagar Society, B/h. Rutaraj Complex, Vasna Road, Vadodra-390015.
3. Details of the order admitting the application	Honble NCLT, Ahmedabad Court - I admitted the Insolvency Resolution Process against Utkarsh Malvik Hathi/Personal Guarantor of Corporate Debtor (Miku Polymers and Plastics Limited) vide C.P. (IB)/233 (AHM)/2022 (vide order dated Nov 8, 2024) (Copy received on Nov 12, 2024)
4. Insolvency process commencement date in respect of Personal Guarantor under IBC, 2016	November 12, 2024
5. Name and registration number of the Insolvency Professional acting as Resolution Professional	Name: Mr Sunil Kumar Kedia Reg. No. IBI/PA-001/FP-00028/2016-17/10064
6. Address and e-mail of the Resolution Professional, as registered with the Board	Add.: 210/B, 21st Century Business Centre, Nr. Udhna Darwaja, Ring Road, Surat-395002. (Gujarat) Email id: kedia_kedia@yahoo.com 395002. (Gujarat) Email id: kedia_kedia@yahoo.com
7. Address and e-mail to be used for submission of claim and for correspondence with the Resolution Professional	Add.: 210/B, 21st Century Business Centre, Nr. Udhna Darwaja, Ring Road, Surat-395002. Gujarat. Email id: kedia_kedia@yahoo.com ipsunilkedia@gmail.com
8. Last date for submission of claims	13th December 2024
9. Relevant Forms are available at:	https://ibbi.gov.in/en/home/downloads

Notice is hereby given that the National Company Law Tribunal, Ahmedabad ("NCLT") vide Order dated 08th November 2024 (Order received on 12th November 2024) has ordered the commencement of an Insolvency Resolution Process of **Utkarsh Malvik Hathi** Personal Guarantor on 12th November 2024 u/s. 100 of Insolvency & Bankruptcy Code, 2016. The Creditors of **Utkarsh Malvik Hathi** are hereby called upon to submit their claims with proof on or before **13th December 2024** in the prescribed form "Form B" under Regulation 7(1) of the Insolvency and Bankruptcy Code of India (Insolvency Resolution Process for Personal Guarantors to Corporate Debtors) Regulations, 2019 to the Resolution Professional address mentioned against entry No. 7. The Creditors shall submit their claims personal information by way of electronic communications of claims email, courier, speed post or registered letter. Submission of false or misleading proofs of claim shall attract penalties.

Date: 13.11.2024, Place: Surat Signed by: Sunil Kumar Kedia, Resolution Professional

કોએચ બેંક - એચ
પરિશિષ્ટ-IV (નિયમ ૮(૧)) કલમ નોટિસ

જત નીચે સહી કરનાર ને કોએચ બેંક એચ, ભારત ("બેંક") ના અધિકૃત અધિકારી તરીકે સિક્યુરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રીસ્ક મેનેજમેન્ટ એન્ડ ફીનાન્સિયલ એન્ડેરસ એન્ડ એક્સચેન્જ ટ્રસ્ટી લિમિટેડ ("સિક્યુરીટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ", ૨૦૦૨ ની કલમ ૧૩(૧) ને સિક્યુરીટી ઈન્વેસ્ટમેન્ટ (એક્સચેન્જ ટ્રસ્ટ) ૨૦૦૨ સુધી નિયમ ૩ વાંચતા મુજબ આપવામાં આવેલ અધિકારોની રૂઠુંએ તારીખ ૧૮-૦૫-૨૦૨૪ ના રોજની ડીમાન્ડ નોટિસ બજવાથી કરીને કલમ ૧૦૨(૧) મેસર્સ ટેકસ્ટાઇલ પ્રા. લિ. (કર્જદાર), શ્રી હરજીવ દાસ અમદાવાદ યોધરી (સહ-કર્જદાર) અને શ્રીમતી વંદના ઠાકરભાઈ યોધરી (સહ-કર્જદાર) ને નોટિસમાં જણાવેલ રકમ રૂ. ૨,૧૨,૭૫,૮૯૦.૨૪/- (અંકે રૂપિયા બે કરોડ બાર લાખ પંચોત્તેર હજાર આઠસો સતાસાત અને ચોવીસ પૈસા પુરા) નોટિસ મળ્યાની તારીખથી દિન-૬૦ માં ભરવાઈ કરી આપવા માટે જણાવેલ છે. આથી કરજદાર દર્શાવેલ રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી કરજદારને ખાસ જાણ કરવામાં આવે છે અને સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે, નીચે સહી કરનાર તેઓને આપવામાં આવેલ અધિકારોની રૂઠુંએ સદરહુ કાયદાની કલમ ૧૩(૪) ને સદરહુ કાયદાના નિયમ ૮ સાથે વાંચતા તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ નીચે જણાવેલ મિલકતનો રચનાત્મક કબજો લઈ લીધેલ છે.

ખાસ કરીને કરજદારને અને જાહેર જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે, સદરહુ મિલકત સંબંધે કોઈપણ વ્યવહાર/સોદો કરવો નહિ અને સદરહુ મિલકત સંબંધે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર બેંક ના રૂ. ૨,૧૨,૭૫,૮૯૦.૨૪/- (અંકે રૂપિયા બે કરોડ બાર લાખ પંચોત્તેર હજાર આઠસો સતાસાત અને ચોવીસ પૈસા પુરા) અને તેના ઉપર વ્યાજના બોજાને આધીન રહેશે.

કર્જદારનું ધ્યાન અધિનિયમની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ તરફ આમંત્રિત કરવામાં આવે છે ઉપલબ્ધ સમયાં સંદર્ભમાં સિક્કોર્ડ અરજચામતો રિકમ કરવા માટે.

સ્થાયર મિલકતનું વર્ણન:
મિલકત નં. ૧ : "ઓફિસ નં. ૪૦૧, ચોથો માળ, ૬૫૩ ચો.ફુટ (સુપર બિલ્ડ અપ) મુનિસુવર નવરંગપુરા-નોન ટ્રેડિંગ કોર્પોરેશનના સભ્ય તરીકે "અભિરાજ કોમ્પ્લેક્સ" તરીકે ઓળખાય છે, જે સ્ટ્રક્ચર કોન્ટ્રોલિંગ હોલ્ડિંગ સોસાયટી લિમિટેડના પેટા-વ્યોટ નંબર ૬૮-બી, ફાઈનલ વ્યોટ-૨૪૨, ટીપીએસ ૩ પર બંધવામાં આવેલ છે. મોજે શોખપુર-આનપુર, તાલુકો સાબરમતી, જિલ્લો અમદાવાદ અને નોંધણી પેટા જિલ્લો અમદાવાદ-૨ (સેમનગર) ખાતે સ્થિત છે, જેની ચુસ્તીમાં : પૂર્વમાં: પેસેજ, પશ્ચિમમાં: આંતરિક રોડ, ઉત્તરમાં: ઓફિસ નં. ૫૦૮, દક્ષિણમાં: ઓફિસ નં. ૫૦૬
મિલકત નં. ૨ : ફલેટ નંબર બી-૦૦૧, સાતમા માળે જેનું ક્ષેત્રફળ ૩૩૦ ચોરસ યાર્ડ એટલે કે ૨૭૫.૮૨૨ ચો. મી., કામચંદર શાંતિ માલિક એસોસિએશનના સભ્ય તરીકે (રજિસ્ટર્ડ નંબર જી-૫૭૦૦ તારીખ ૦૨-૦૨-૮૩) જે "રનાકર" તરીકે ઓળખાય છે, અને તે (ત્યારબાદ "અનુચિત મિલકત") (રજિસ્ટર્ડ) તરીકે ઓળખાય છે જે સર્વે નંબર ૨૨૫ (વેજલપુરનો જૂનો સર્વે નં. ૩૨૦), ફાઈનલ વ્યોટ નં. ૧૪૦, ટીપીએસ ૫, મોજે શોખપુર, તાલુકો વેજલપુર, જિલ્લો અમદાવાદ ખાતે સ્થિત છે અને તેનું રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૪ (પાલડી) છે. જેની ચુસ્તીમાં: પૂર્વમાં: પેસેજ અને ફલેટ નં. ૭૦૨, પશ્ચિમમાં: કોમન વ્યોટ, ઉત્તરમાં: સીડી, દક્ષિણમાં: લિક્ટ.

અધિકૃત અધિકારી,
(મહિલા નવરંગપુરા સુપરવિહિત)
કોએચ બેંક - એચ

તા. : ૧૪-૧૧-૨૦૨૪
સ્થાન : અમદાવાદ

ULTRACAB (INDIA) LIMITED
Survey No. 262, B/h. Galaxy Bearings Ltd., Shapur (Veraval) - 360024 Dist. - Rajkot Gujarat
CIN: L31300GJ2007PLC052394

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30th SEPTEMBER, 2024


Sr. No.	Particular	QUARTER ENDED		SIX MONTH ENDED		YEAR ENDED
		30.09.2024 UNAUDITED	30.06.2024 UNAUDITED	30.09.2023 UNAUDITED	30.09.2023 UNAUDITED	31.03.2024 AUDITED
1	Total Income from Operations	5554.70	5369.45	3122.62	10924.14	5744.37
2	Net Profit before Extra-Ordinary and Exceptional Items	328.77	292.26	194.79	621.03	337.86
3	Net Profit before Tax (PBT)	328.26	292.15	195.58	620.41	338.65
4	Net Profit after Tax (PAT)	250.64	212.74	153.32	463.38	256.44
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	250.64	212.74	153.32	463.38	256.44
6	Paid-up Equity Share Capital	1908.45	1908.45	1908.45	1908.45	1908.45
7	Other equity / Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	1887.75
8	Earnings per Share (Face Value Rs. 02 per share) (not annualised)	0.26	0.22	0.16	0.49	0.27
a)	Basic	0.26	0.22	0.16	0.49	0.27
b)	Diluted	0.26	0.22	0.16	0.49	0.27

1. The above is an extract of the detailed format of Unaudited Standalone Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results is available on the stock exchange website (www.bseindia.com) and Company's website (www.ultracabwires.com)

2. The above results are reviewed by the Audit Committee and were approved and taken on record by the Board of Directors at its meeting held on 12.11.2024.

For and on behalf of Board of Directors of
ULTRACAB (INDIA) LIMITED
sd/-
Mr. Nitesh P. Vaghiasya
Chairman & Managing Director
DIN: 01899455

Place: Rajkot
Date: 12.11.2024



LENDINGKART
Simplifying MSME Finance
LENDINGKART FINANCE LIMITED
CIN: U65910MH1996PLC258722

Registered Office: Unit Number PS 40 and PS 41, 3rd Floor, Birla Centurion, Pandurang Budhkar Marg, Worli Mumbai - 400030.
Corporate Office: 401, 4th Floor, Iconic Shyamal, Nr. Shyamal Cross-Roads, Ahmedabad, 380 015, Gujarat, India.
Phone: +91-7228901863 | Email: lendingkartfinance@lendingkart.com | website: https://lendingkartfinance.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS
(Amount, in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Year Ended
		September 30, 2024 (Unaudited)	September 30, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)
1.	Total Income from Operations	22,190.06	29,434.41	1,07,165.70
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(8,772.36)	3,892.58	8,031.35
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(8,772.36)	3,892.58	8,031.35
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(6,566.58)	2,912.13	6,007.55
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(6,566.58)	2,907.79	5,982.98
6.	Paid up Equity Share Capital	4,418.79	4,418.79	4,418.79
7.	Reserves (excluding Revaluation Reserve)	67,841.07	74,418.48	75,691.47
8.	Securities Premium Account	67,246.84	67,246.84	67,246.84
9.	Net worth	72,259.86	78,837.27	80,110.26
10.	Paid up Debt Capital / Outstanding Debt	2,04,291.49	2,08,718.74	2,43,101.02
11.	Outstanding Redeemable Preference Shares	NIL	NIL	NIL
12.	Debt Equity Ratio	2.83	2.65	3.03
13.	Earnings Per Share (Face value of ₹10/- each) (for continuing and discontinued operations) (Not Annualised)	(14.85)	6.59	13.60
14.	Capital Redemption Reserve	NIL	NIL	NIL
15.	Debenture Redemption Reserve	NIL	NIL	NIL
16.	Debt Service Coverage Ratio	NA	NA	NA
17.	Interest Service Coverage Ratio	NA	NA	NA

#- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

Notes:
a) The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchange under Regulation 52 of the LODR Regulations. The full format of the quarterly financial results are available on the website of the Stock Exchange (https://www.bseindia.com) and on the Company's website (https://lendingkartfinance.com).
b) For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Stock Exchange (BSE Ltd) and can be accessed on the URL (https://www.bseindia.com).
c) Accounting principles and policies followed are in line with March 2024 and there is no change in such principles and policies during quarter or half year ended on September 30, 2024.

On behalf of the Board of Directors of
Lendingkart Finance Limited
sd/-
Harshvardhan Lunia
Chairman & Managing Director
DIN: 01189114

Place : Ahmedabad
Date : November 13, 2024

Bank of Baroda
રામાનું સરનામું : Gen-Next ઈલેક્ટ્રોનિકી સામા, આઉટ ડુલો, ઈન્ડોર સીટી હબ, આઈ.ટી. ટાવર-૨, ગોંડીનગર - ૩૮૨૦૦૬. ઈમેલ : infoc@bankofbaroda.com

કિમાન્ડ નોટિસ
સિક્યુરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રીસ્ક મેનેજમેન્ટ એન્ડ એક્સચેન્જ ટ્રસ્ટી લિમિટેડ ("સિક્યુરીટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ", ૨૦૦૨ ની કલમ ૧૩(૧) ને સિક્યુરીટી ઈન્વેસ્ટમેન્ટ (એક્સચેન્જ ટ્રસ્ટ) ૨૦૦૨ સુધી નિયમ ૩ વાંચતા મુજબ આપવામાં આવેલ અધિકારોની રૂઠુંએ તારીખ ૧૮-૦૫-૨૦૨૪ ના રોજની ડીમાન્ડ નોટિસ બજવાથી કરીને કલમ ૧૦૨(૧) મેસર્સ ટેકસ્ટાઇલ પ્રા. લિ. (કર્જદાર), શ્રી હરજીવ દાસ અમદાવાદ યોધરી (સહ-કર્જદાર) અને શ્રીમતી વંદના ઠાકરભાઈ યોધરી (સહ-કર્જદાર) ને નોટિસમાં જણાવેલ રકમ રૂ. ૨,૧૨,૭૫,૮૯૦.૨૪/- (અંકે રૂપિયા બે કરોડ બાર લાખ પંચોત્તેર હજાર આઠસો સતાસાત અને ચોવીસ પૈસા પુરા) નોટિસ મળ્યાની તારીખથી દિન-૬૦ માં ભરવાઈ કરી આપવા માટે જણાવેલ છે. આથી કરજદાર દર્શાવેલ રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી કરજદારને ખાસ જાણ કરવામાં આવે છે અને સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે, નીચે સહી કરનાર તેઓને આપવામાં આવેલ અધિકારોની રૂઠુંએ સદરહુ કાયદાની કલમ ૧૩(૪) ને સદરહુ કાયદાના નિયમ ૮ સાથે વાંચતા તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ નીચે જણાવેલ મિલકતનો રચનાત્મક કબજો લઈ લીધેલ છે.

ખાસ કરીને કરજદારને અને જાહેર જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે, સદરહુ મિલકત સંબંધે કોઈપણ વ્યવહાર/સોદો કરવો નહિ અને સદરહુ મિલકત સંબંધે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર બેંક ના રૂ. ૨,૧૨,૭૫,૮૯૦.૨૪/- (અંકે રૂપિયા બે કરોડ બાર લાખ પંચોત્તેર હજાર આઠસો સતાસાત અને ચોવીસ પૈસા પુરા) અને તેના ઉપર વ્યાજના બોજાને આધીન રહેશે.

કર્જદારનું ધ્યાન અધિનિયમની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ તરફ આમંત્રિત કરવામાં આવે છે ઉપલબ્ધ સમયાં સંદર્ભમાં સિક્કોર્ડ અરજચામતો રિકમ કરવા માટે.

સ્થાયર મિલકતનું વર્ણન:
મિલકત નં. ૧ : "ઓફિસ નં. ૪૦૧, ચોથો માળ, ૬૫૩ ચો.ફુટ (સુપર બિલ્ડ અપ) મુનિસુવર નવરંગપુરા-નોન ટ્રેડિંગ કોર્પોરેશનના સભ્ય તરીકે "અભિરાજ કોમ્પ્લેક્સ" તરીકે ઓળખાય છે, જે સ્ટ્રક્ચર કોન્ટ્રોલિંગ હોલ્ડિંગ સોસાયટી લિમિટેડના પેટા-વ્યોટ નંબર ૬૮-બી, ફાઈનલ વ્યોટ-૨૪૨, ટીપીએસ ૩ પર બંધવામાં આવેલ છે. મોજે શોખપુર-આનપુર, તાલુકો સાબરમતી, જિલ્લો અમદાવાદ અને નોંધણી પેટા જિલ્લો અમદાવાદ-૨ (સેમનગર) ખાતે સ્થિત છે, જેની ચુસ્તીમાં : પૂર્વમાં: પેસેજ, પશ્ચિમમાં: આંતરિક રોડ, ઉત્તરમાં: ઓફિસ નં. ૫૦૮, દક્ષિણમાં: ઓફિસ નં. ૫૦૬
મિલકત નં. ૨ : ફલેટ નંબર બી-૦૦૧, સાતમા માળે જેનું ક્ષેત્રફળ ૩૩૦ ચોરસ યાર્ડ એટલે કે ૨૭૫.૮૨૨ ચો. મી., કામચંદર શાંતિ માલિક એસોસિએશનના સભ્ય તરીકે (રજિસ્ટર્ડ નંબર જી-૫૭૦૦ તારીખ ૦૨-૦૨-૮૩) જે "રનાકર" તરીકે ઓળખાય છે, અને તે (ત્યારબાદ "અનુચિત મિલકત") (રજિસ્ટર્ડ) તરીકે ઓળખાય છે જે સર્વે નંબર ૨૨૫ (વેજલપુરનો જૂનો સર્વે નં. ૩૨૦), ફાઈનલ વ્યોટ નં. ૧૪૦, ટીપીએસ ૫, મોજે શોખપુર, તાલુકો વેજલપુર, જિલ્લો અમદાવાદ ખાતે સ્થિત છે અને તેનું રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૪ (પાલડી) છે. જેની ચુસ્તીમાં: પૂર્વમાં: પેસેજ અને ફલેટ નં. ૭૦૨, પશ્ચિમમાં: કોમન વ્યોટ, ઉત્તરમાં: સીડી, દક્ષિણમાં: લિક્ટ.

અધિકૃત અધિકારી,
(મહિલા નવરંગપુરા સુપરવિહિત)
કોએચ બેંક - એચ

તા. : ૧૪-૧૧-૨૦૨૪
સ્થાન : અમદાવાદ

TGB BANQUETS AND HOTELS LIMITED
CIN: L55100GJ1999PLC036830

Regd. Office: "The Grand Bhagwati", Plot No. 380, S.G. Road, Bodakdev, Ahmedabad - 380054
E-mail: info@tgbhotels.com Website: www.tgbhotels.com Tel. 079-26841000

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30th SEPTEMBER, 2024
(Rs In lakhs except EPS)

Sr. No.	Particulars	Standalone					
		Quarter Ended		Half Year Ended		Year Ended	
		30.09.2024 Unaudited	30.06.2024 Unaudited	30.09.2023 Unaudited	30.09.2024 Unaudited	30.09.2023 Unaudited	31.03.2024 Audited
1	Total Income from Operation (net)	882.42	736.45	912.03	1618.87	1703.78	4,026.01
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	21.07	13.59	17.98	34.66	34.79	-354.20
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	21.07	13.59	17.98	34.66	34.79	-354.20
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	21.07	13.59	17.98	34.66	34.79	-356.01
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax and other comprehensive)]	21.07	13.59	17.98	34.66	34.79	-348.53
6	Equity Share Capital (Face Value of Rs. 10 each)	2928.64	2928.64	2928.64	2928.64	2928.64	2928.64
7	Other Equity	-	-	-	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) for continuing / discontinuing operation	0.07	0.05	0.06	0.12	0.12	-1.22
1)	Basic	0.07	0.05	0.06	0.12	0.12	-1.22
2)	Diluted	0.07	0.05	0.06	0.12	0.12	-1.22

Notes:
1 The above is an extract of the detailed format of Standalone Financial Results for the Quarter and half year ended on 30th September 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Standalone Financial Results for the Quarter and half year ended on 30th September 2024 are available on the Stock Exchange websites i.e. www.nseindia.com, www.bseindia.com and on the company's website www.tgbhotels.com.

For, TGB Banquets and Hotels Limited
Narendra G. Somani
Chairman & Managing Director
(DIN: 00054229)

Place : Ahmedabad
Date : November 13, 2024

JINDAL **JINDAL WORLDWIDE LIMITED**
CIN : L17110GJ1986PLC008942
Regd. & Corp. Office : "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad -380015
Phone: 079-71001500 • Email Id: csjindal@jindaltextiles.com • Website : www.jindaltextiles.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter & Half Year Ended 30th September, 2024 (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015)
(Rs. In Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		3 months ended of C.Y. 30th Sept, 2024 (Un-Audited)	Preceding 3 months ended 30th June, 2024 (Un-Audited)	Corr. 3 months ended in P.Y. 30th Sept, 2023 (Un-Audited)	6 months ended of C.Y. 30th Sept, 2024 (Un-Audited)	6 months ended of P.Y. 30th Sept, 2023 (Un-Audited)
STANDALONE						
1.	Total income from operations (net)	56758.92	51536.56	40019.89	108295.48	81856.19
2.	Net Profit / (Loss) for the period (before Tax , Exceptional and / or Extraordinary items)	2343.22	2327.22	1525.75	4670.44	3436.21
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	2343.22	2327.22	1525.75	4670.44	3436.21
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items)	1746.65	1742.65	1217.90	3489.30	2571.30
5.	Total Comprehensive Income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1746.65	1742.65	1217.90	3489.30	2571.30
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2024	-	-	-	-	69042.96
8.	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.87	0.87	0.61	1.74	1.28
	2. Diluted	0.87	0.87	0.61	1.74	1.28
CONSOLIDATED						
1.	Total income from operations (net)	57080.62	48743.07	39182.52	105823.69	80252.95
2.	Net Profit / (Loss) for the period (before Tax Exceptional and / or Extraordinary items)	2359.31	2445.91	1626.24	4805.22	3556.80
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	2359.31	2445.91	1626.24	4805.22	3556.80
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items)	1733.56	1806.30	1275.51	353	